




ધી સંતરામપુર અર્બન કો.ઓપરેટીવ બેન્ક લી. સંતરામપુર



RUPAY ATM CUM DEBIT CARD મેળવવા માટેનું અરજી ફોર્મ

પ્રતિ,

મેનેજરશ્રી,

ધી સંતરામપુર અર્બન કો.ઓપરેટીવ બેન્ક લી.

શાખા.....સંતરામપુર

તારીખ : / /

હું અમો આપની બેંકની નીચે જણાવ્યા મુજબની સેવાનો લાભ લેવા માટે ઇચ્છુક છું / છીએ. જે મુજબ મારી અમારી સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

[] RUPAY ATM CUM DEBIT CARD (રૂપે ATM કમ ડેબીટ કાર્ડ)

[] NEW (નવું) [] DUPLICATE (ડુપ્લિકેટ)

ખાતાની માહિતી :-

૧. કસ્ટમર ID :

૨. ખાતેદારનું નામ :

૩. ખાતા નંબર :

૪. ખાતાનો પ્રકાર : સેવિંગ્સ ☐ ચાલુ ☐

૫. E-Mail :

૬. ખાતામાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર :

૭. પત્રવ્યવહારનું સરનામું :

હું / અમો એ બેંકની તમામ વેલ્યુએડેડ સર્વિસ તથા ATM CUM RUPAY DEBIT CARD ના ઉપયોગ અને સંચાલન અંગેની તમામ શરતો અને નિયમો બરાબર વાંચેલ તેમજ સમજેલ છે. જે હું / અમો સ્વીકારીએ છીએ. આ તમામ શરતો અને નિયમોમાં સમયે સમયે બેંક દ્વારા કરવામાં આવતા ફેરફારો કોઈ પણ જાણ વગર પણ મને / અમોને સ્વીકાર્ય છે. હું / અમો આ સંપૂર્ણ જવાબદારી સ્વીકારીએ છીએ. જે અંગે ભવિષ્યમાં ધી સંતરામપુર અર્બન કો. ઓપરેટીવ બેન્ક લી. સંતરામપુર પર કોઈપણ પ્રકારનો દાવો કે વાંધો વિરોધ ન કરવા અંગે સંમત છું / છીએ. ઉપરોક્ત અરજીમાં જણાવેલ વિગતો નમુના મુજબની સહીઓ / સહી જે મે ખાતુ ખોલાવતી વખતે આપેલ છે. જે સાચી અને ખરી છે. તેમજ KYC નાં તમામ નિયમોનું મે / અમોએ પાલન કરેલ છે.

ATM કાર્ડ બ્લોક કરવા માટે

એકાઉન્ટમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર

ઉપરથી 9227776000 માં ફોન કરી

જાણ કરવાની રહેશે.

(ખાતેદારની સહી) (સહી નમુના મુજબની કરવી)

FOR BANK USE ONLY

Signature of customer and mode of Operation of the accounts verified, charges levied (Lost / Replacement card only) and here by authorised to issue the GCCB BANK RU-PAY Debit Card

Reason for Issue	ATM Card
New	
Lost	
Damaged	
Others	

OPERATOR SIGNATURE

SIGNATURE OF THE VERIFYING AUTHORITY



ધી સંતરામપુર અર્બન કો.ઓપરેટીવ બેન્ક લી. સંતરામપુર



ATM કાર્ડ માટેના નિતી નિયમો

ATM કાર્ડનો ઉપયોગ માટેના જરૂરી નિતીનિયમો નીચે જણાવ્યા મુજબ છે. જે મને / અમોને સ્વીકાર્ય છે.

(૧) ATM કાર્ડ

- ✓ કાર્ડ એ બેંકની મિલકત છે. અને બેંક દ્વારા માંગણી કરતા કોઈપણ વાંધાવિરોધ વિના પરત કરવાનું રહેશે.
- ✓ બેંક કોઈપણ સુચના વિના કાર્ડ બંધ કરી શકશે અને નાણાકીય વ્યવહારો સ્થગીત કરી શકશે.
- ✓ કાર્ડ બિન તબદિલ પાત્ર છે.

ATM કાર્ડ બ્લોક કરવા માટે એકાઉન્ટમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપરથી 92277 76000 માં ફોન કરી જાણ કરવાની રહેશે.

(૨) PIN નંબર

કાર્ડ ધારકને ૪ આંકડાનો PIN નંબર ફાળવવામાં આવશે. જે ગુપ્ત અને સીલબંધ કરવામાં કરવામાં હશે. આથી કાર્ડ ધારકને તેના હિતમાં સુચન કરવામાં આવે છે કે ગ્રાહકે પોતાનો ૪ આંકડાનો PIN નંબર પોતાની જરૂરીયાત મુજબ બદલી દેવો યોગ્ય છે. જે માટે ATM કાર્ડ ધારકે ATM ની મુલાકાત લેવી. અથવા રજીસ્ટર્ડ મોબાઈલમાં (SARVATRA CARDSAFE) એપ્લિકેશન ડાઉનલોડ કરી પીન નંબર બદલી શકાશે. PIN ની પસંદગી કરતી વખતે કાર્ડ ધારકે પોતાને સંબંધિત PIN પસંદ કરવો. વધુ યોગ્ય છે. જેથી ભવિષ્યમાં PIN યાદ રાખવો સરળ બને. કાર્ડ ધારકે પોતાનું કાર્ડ તથા પીન નંબર પોતાને હસ્તક સલામત રીતે રાખવું અન્યથા અન્ય કોઈ વ્યક્તિ પાસે જો કાર્ડ તથા પીન નંબર આવશે તો તે આપના ATM કાર્ડ અને ખાતાનો ગેરઉપયોગ કરી શકે છે. આમ ATM કાર્ડના ગેરકાયદેસર ઉપયોગ માટે બેંક કોઈપણ રીતે જવાબદાર રહેશે નહિ. આમ બેંક ATM કાર્ડના ગુમ થવા કે નુકશાની થવાના કીસ્સામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર રહેશે નહી.

(૩) ATM કાર્ડનું ગુમ થવું.

- ✓ ATM કાર્ડનું ગુમ થવાના કે ચોરાઈ જવાના કીસ્સામાં કાર્ડ ધારકે તુરંત અસરથી બેંકનો સંપર્ક કરવો અથવા MISS CALL NO 92277 76000 ઉપર CALL કરી કાર્ડ બ્લોક કરાવવું
- ✓ તદઉપરાંત પીન નંબર ભુલથી જાહેર થવા કે ચોરાઈ જવાના સંજોગોમાં તાત્કાલીક ધોરણે પીન નંબર બદલી નાખવો હિતાવહ છે
- ✓ ગુમ થયેલ કાર્ડના બદલામાં ખાતાધારકે ફાળવવામાં આવેલ
- ✓ (૧) નવા ATM કાર્ડ માટે રૂ. ૨૦૦ + GST
- ✓ (૨) પીન નંબર બદલવાનો ચાર્જ રૂ. ૩૦ + GST ચુકવવાનો રહેશે. (પીન નંબર ભુલી જવાના કીસ્સામાં)

(૪) ગ્રાહકના ખાતામાં ઉધારેલ રકમ

- ✓ બેંક પાસે ખાતેદારે ATM કાર્ડના ઉપયોગથી કરેલ બધાજ રોકડ ઉપાડ કે ટ્રાન્સફર વ્યવહારની રકમ ઉધારવાનો મુખ્ય અધિકાર રહેશે. જે માટે ખાતેદાર બંધાયેલ રહેશે. તદઉપરાંત બેંક પાસે ખાતેદારના ખાતે સમયાંતરે ઉધારવામાં આવતા સર્વિસટેક્સ નો અધિકાર રહેશે.

(૫) ખાતુ બંધ કરવું.

જો ખાતેદાર ખાતુ બંધ કરવા ઇચ્છે કે કાર્ડ પરત કરવા માંગે તો આવા સંજોગોમાં બેંકને જાણ કરવી જરૂરી છે. જે બદલ ખાતેદારને કોઈ પણ ચાર્જ પરત કરવામાં આવશે નહી.

(૬) ATM કાર્ડની મુદત ૫ (પાંચ) વર્ષની રહેશે.

- (૭) ફાસ્ટ કેશ :- ATMમાં અગાઉથી દર્શાવેલ રકમ (જેમ કે રૂ. ૧૦૦૦, ૩૦૦૦, ૫૦૦૦) નો ઉપાડ સરળતાથી થઈ શકશે. ભવિષ્યમાં ચાર્જીસ લાગુ થાયતો બંધનકર્તા રહેશે.

- ✓ નાણાકીય ઉપાડ :- ATMમાં રોકડ ઉપાડની લઘુત્તમ રકમ રૂ. ૧૦૦ તથા મહત્તમ રૂ. ૩૦૦૦૦ રહેશે. જેમાં ફેરફાર કરવાની સત્તા બેંકને રહેશે
- ✓ બીન નાણાકીય વ્યવહાર :- મહત્તમ રૂ. ૨૫૦૦૦ નો વ્યવહાર થઈ શકશે.

(૮) ATM ઉપાડ :- પ્રતિ નાણાકીય વ્યવહાર દીઠ રૂ. ૨૦ + GST

પ્રતિ બીન નાણાકીય વ્યવહાર દીઠ રૂ. ૮ + GST

(માસીક ૫ (પાંચ) નાણાકીય / બીન નાણાકીય વ્યવહાર વીના મૂલ્ય રહેશે)

(૯) ATM સેવા લેનાર ખાતેદારે પોતાના બચત ખાતામાં રૂ. ૧૦૦૦ અને ચાલુ ખાતામાં રૂ. ૩૦૦૦ મીનીમમ બેલેન્સ જાળવી રાખવાનું રહેશે.

ઉપર જણાવેલ નીયમો મને મંજૂર છે

તારીખ :-

ઉપરના નીતીનિયમો સ્વીકારવા બદલ કાર્ડ ધારણ કરનારની સહિ